

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩/૬/૨૦૧૫ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૧૨૯/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૪ કેસ કરી ૧૧ વ્યક્તિઓને ઝડપી, ૯૭ લીટર દેશી દારૂ અને ૦૫ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૩૦/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ. ૯૩ મુજબ ૧૫ વ્યક્તિઓની અને ૦૩ વ્યક્તિઓની પાસા હેઠળ અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૧૩૧/૧૫

સોલા હાઇકોર્ટ : મહેપાતસિંગ પુરણસિંગ વર્મા (રહે.સુર્યવંશી, ટાવર મેનેજમેન્ટ, એકલવ્ય સામે, વસ્ત્રાપુર) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧/૬/૧૫ બપોરનાં ૧૨/૦૦ વાગ્યાનાં સુમારે કોઈ અજાણી વ્યક્તિ થલતેજ શીલજ રોડ ઉપર આવેલ મેપલ કાઉન્ટી વિભાગ-૧ તેમજ વિભાગ-૨ ની લીફ્ટની ડ્રાઇવ નંગ-૫ કુલ કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એમ.પટ્ટણી ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૧૩૨/૧૫

સરદારનગર : રોહીતકુમાર બાબુભાઈ પટેલ (રહે,સીલીકોન્સ સોસાયટી, ઉમા સ્કુલની પાછળ, નરોડા) એ તા.૨/૬/૧૫ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૫/૧૫ સવારના ૧૦/૦૦ વાગ્યાના સુમારે હાંસોલ કોમ્યુનીટી હોલ પાસે, ધનલક્ષ્મી સોસાયટીની ગતીમાંથી ચાલતાં પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાનો) રોહીતકુમારના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એલ.જી.ખરાડી ચલાવે છે.

વાહનચોરી :-

સમાચાર યાદી નં.૧૧૩૩/૧૫

નરોડા : દિનેશચંદ્ર મોહનલાલ પટેલ (રહે: સાગર ટેનામેન્ટ, કઠવાડા રોડ, નવા નરોડા) એ તા.૧૮/૫/૧૫ સાંજનાં ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પોતાની ફ્ન્ટી કાર નંબર જીજે.૧.એચ.એલ.૧૩૪૪ કિંમત રૂપિયા ૬૫,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૧૯/૫/૧૫ સવારનાં ૭/૩૦ વાગ્યા દરમ્યાન થઇ હતી. આ અંગેની ફરીયાદ દિનેશચંદ્ર પટેલે તા.૨/૬/૧૫ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એચ.જાડેજા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૧૩૪/૧૫

ઓઢવ : બીગનસિંગ ઉમાસિંગ રાજપુત (રહે, ગજાનંદ પાર્ક, એકતાનગર સોસાયટીની બાજુમાં, સિંગરવા તા.દસ્કોઇ) એ તા.૨/૬/૧૫ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૫/૧૫ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે સિંગરવા ખોડીયાર માતાના મંદિર પાસેથી પોતાનો ભાઇ નિર્ભયસિંગ ઉમાસિંગ રાજપુત (ઉ.વ.૨૪) પોતાનું મોટર સાયકલ ચલાવી પસાર થઇ રહ્યો હતો. દરમ્યાન એક અજાણ્યા મોટર સાયકલનાં ચાલકે પોતાનું મોટર સાયકલ પુરઝડપે અને ગડલતભરી રીતે ચલાવી લાવી, નિર્ભયસિંગનાં મોટર સાયકલને ટક્કર મારતાં, નિર્ભયસિંગને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨/૬/૧૫ બપોરનાં ૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી રાકેશકુમાર ત્રિભોવનદાસ ચલાવે છે

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૧૧૩૫/૧૫

રિવરફ્રન્ટ (ઇસ્ટ) : રિતેશભાઇ ઘનશ્યામભાઇ પંચાલ (ઉ.વ.૪૬)(રહે.ભુરાભાઇનું ડહેલુ, મોટી પોળની સામે, કડીયાનાકા, દરીયાપુર) એ તા.૧/૬/૧૫ નારોજ કોઇપણ સમયે કોઇ અગમ્ય કારણસર સુભાષબ્રીજ પાસે, સાબરમતી નદીમાં ડુબી જઇ, આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રિવરફ્રન્ટ(ઇસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી આર.વી.મકવાણા ચલાવે છે.

(ઇ.ચા.)નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.